

For Our World

We need to stop.
Just stop.
Stop for a moment...
Before anybody
Says or does anything
That may hurt anyone else.
We need to be silent.
Just silent.
Silent for a moment...
Before we forever lose
The blessing of songs
That grow in our hearts.
We need to notice.
Just notice.
Notice for a moment...
Before the future slips away
Into ashes and dust of humility.
Stop, be silent, and notice...
In so many ways, we are the same.
Our differences are unique treasures.
We have, we are, a mosaic of gifts
To nurture, to offer, to accept.
We need to be.
Just be.
Be for a moment...
Kind and gentle, innocent and trusting,
Like children and lambs,
Never judging or vengeful
Like the judging and vengeful.
And now, let us pray,
Differently, yet together,
Before there is no earth, no life,
No chance for peace.

Mattie J.T. Stepanek ©
September 11, 2001
Hope Through Heartsongs
Hyperion, 2002
Just Peace: A Message of Hope
Andrews McMeel, 2006

www.mattieonline.com

આપણા વિશ્વ માટે

આપણે થોભવાનું છે
ખાલી થોભવાનું
થોભવાનું છે એક પણ
એ પેહલા
કે કોઈ કહે કે કરે
તે જે કોઈ બીજાને ને દુભાવે.
આપણે યુપ રેહવાનું છે
ખાલી યુપ રેહવાનું
યુપ રેહવાનું એક પણ
એ પેહલા કે ખોવાઈ જાય
હમેશ ને માટે
પ્રસાદ ગીતો નો જે
ઉમટ્યો છે ક્ષિદય માં
આપણે જોવાનું છે
ખાલી જોવાનું
જોવાનું છે એક પણ
એ પેહલા કે સરી જાએ ભવિષ્ય
ધૂળ અને રાખ બની વિનય ના
થોભો, યુપ રહો, અને જુઓ
કેટ કેટલી વિવિધતા પણ એક
આપણી વિવિધતા એજ અનોખો રત્નકોષ
છે આ, આપણેજ એક રત્નશીલા
પોષવા, આપવા, લેવા.
આપણે રહેવાનું છે.
ખાલી રહેવાનું છે
એક ક્ષણ માટે
કૃપાળુ અને સૌમ્ય, નિર્મળ અને શ્રદ્ધ
જેમ બાળક અને ઘેટાં.
ના ક્યારેય કરીએ મૂલ્યાંકન કે પ્રતીહિંસા
ન થઈએ એવા.
અને હવે ઉપાસના કરીએ
જુદા જુદા પણ એક
એ પેહલા કે રહે ન ધરતી, ન જીવન
ન કોઈ આશા શાંતિ ની.

Mattie J.T. Stepanek
© September 11, 2001

Gujarati translation is by Sujata Cowlagi
www.mattieonline.com